

કાવ્યપંક્તિનો વિચાર વિસ્તાર

ફૂલથી માટી મહેકતી, ફૂલથી મહેકે પ્રીત,
મહેકી મહેકી મટી જવું, એની નોખી રીત

પ્રસ્તુત પંક્તિમાં કવિ મણિલાલ પટેલ મહેકીને સુવાસિત કરવાના પુષ્પના ગુણધર્મો વાત કરે છે. પુષ્પ પોતાની સુવાસથી ધરતીને સુગંધિત કરે છે, પ્રેમનું પ્રતીક બનીને પ્રણયમાં પરિમલ પ્રસરાવે છે અને પોતે મહેકીને, અંતે મટી જઈને પોતાની સાર્થકતા સિદ્ધ કરે છે.

અહીં કવિ જીવનની સાર્થકતાની વાત પુષ્પના પ્રતિક દ્વારા આપણી સમક્ષ મૂકે છે. ફૂલની સુગંધથી આસપાસની ધરતી મહેકી ઉઠે છે, કવિ અહીં માટીને મહેકવવાની વાત કરે છે, ફૂલ જે માટીમાં ઊગ્યું છે તેને સુવાસિત કરવાની વાત કરે છે. માટીને પુષ્પની જન્મભૂમિ છે. પુષ્પ જાણે છે કે પોતાનો પમરાટ ફેલાવીને માતૃભૂમિનું ઋણ અદા કરે છે. ફૂલની જેમ સજનો પોતાના સત્કર્મોથી જે ભૂમિમાં પેદા થયા છે તેને સુવાસિત કરે છે. સ્નેહરશ્મિએ તેમના એક હાઈકુમાં 'રંગ-વિહોણી માટી' માં ફૂલ રંગ પુરે છે તેવી કલ્પના કરી છે. પુષ્પ માત્ર ધરતીમાં સુવાસ ફેલાવે છે તેવું નથી, તે પ્રણયમાં પણ પોતાની મોહક સુવાસ ફેલાવે છે. ફૂલ એ પ્રેમનું પ્રતીક પણ છે જે અંગ્રેજ કવિ રોબર્ટ બન્સ કહે છે :

"MY LOVE IS LIKE A RED, RED ROSE."

પ્રેમીઓ દ્વારા થતી ફૂલોની આપલે, એકબીજાને ફૂલમાળા પહેરાવીને લગ્નમંડપમાં જાહેરમાં કરતો પ્રેમનો એકરાર, સાથે જીવવા-મરવાનો કોલ અને ફૂલોથી શણગારાતો શયનખંડ, આ બધું જ પ્રણયના પમરાટમાં પુષ્પની મહેક છે. પુષ્પો પ્રણયને મહેકવવાનું કામ કરે છે. અને બદલામાં પુષ્પો શું માંગે છે? કશું જ નહીં. એમને તો ચોમેર સુવાસ ફેલાવવાની ફના થઈ જવું છે. બીજાને ખાતર સુવાસ ફેલાવીને ફના થઈ જવાની રીત એ દુનિયદારીની નફા-નુકસાનની વેપારી રીત કરતા ખરેખર અનોખી છે. સજનો પણ ફૂલની જેમ પોતાના સત્કર્મોથી માતૃભૂમિને સુવાસિત કરે છે, દુનિયામાં આત્મીયતા

ફેલાવે છે અને પરોપકાર કરતા કરતા પોતાનું બલિદાન આપીને પોતાના જીવનને સાર્થક કરે છે આવા લોકો 'મરીને જીવવાનો મંત્ર' અપનાવે છે.

આમ, સજ્જનો ફૂલોની જેમ સત્કાર્યોની સુવાસ યોમેર ફેલાવીને પરોપકાર કરતા કરતા આત્મબલિદાન આપીને જીવનને સાર્થક બનાવતા હોય છે.

આ બુક ઓનલાઇન મેળવવા
www.mexambooks.com
કિંમત: - 260 || ડિસ્કાઉન્ટ 30 રૂ
ઓનલાઇન કિંમત 230 રૂ

Mission Exam Latest **2018**

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ આયોજિત

કંડકર

ની ભરતી માટે

GSRTC અભ્યાસક્રમ અનુસાર

- ઇલેક્ટ્રોનિક ટિકીટ મશીન ■ મોટર વ્હીકલ એક્ટ
- ભાડા પત્રક ■ કંડકરની કામગીરી અને ફરજો ■ પ્રાથમિક સારવાર

સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબના તમામ ટોપીકનો સમાવેશ

બુક મેળવવા સંપર્ક
8264292929,
9825218065

જરજીસ કાઝી
M.A. English, M.Ed., PGDCA
(Columnist & Text Book Writer)

યશ ડોડિયા
M.A. English, B.Ed.

યશ્વી પબ્લીકેશન
ગીર સોમનાથ

YASHVI PUBLICATION

FOR LATEST GK UPDATE JOIN MISSION EXAM BY JARJIS KAZI CLICK HERE

<http://t.me/missionexambyjarjiskazi>